

DISHA RESOURCES LIMITED

CIN: L74110GJ1995PLC024869

Registered office: 3, Rajesh Apartment, B/h, Ajanta Comm. Estate Off Ashram Road,
Ahmedabad-380014

Contact: 079-2754-0790, 079-27543060

E-mail: disharesourceslimited@gmail.com **Website:** www.disharesourcesltd.com

DRL/SE/2023-24/P17

May 27, 2023

To,

The Manager, Listing

BSE Limited

Phiroze Jeejeebhoy Towers,

Dalal Street,

Mumbai- 400 001

Dear Sir/Madam,

**Sub.: Publication of Audited Standalone Financial Results for the Fourth Quarter and
Year ended as on 31st March, 2023.**

Ref: Company Code: BSE: 531553

With regard to above and in compliance with the Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith copies of Free Press Gujarat (English) and Lok Mitra (Gujarati) edition dated May 27, 2023 in which Audited Standalone Financial Results for the Fourth Quarter and Year ended as on 31st March, 2023 as approved in the meeting of the Board of Directors held on 26th May, 2023 were published.

You are requested to please take note of same.

Thanking You,

Faithfully Yours,

FOR DISHA RESOURCES LIMITED

KRISHNA AWTAR KABRA

MANAGING DIRECTOR

DIN: 00650817

Encl: As Stated

64.6% students clear GSHSEB Class 10 exam

AHMEDABAD: The Gujarat Secondary and Higher Secondary Education Board (GSHSEB) on Thursday declared 64.62% result, marginally lesser than the previous year. While there was no major dip in the pass percentage as compared to the last year, the long shadow of Covid on school education reflected in the result as the

number of students who got A1 grades dropped sharply by 50%. In 2022, 12,090 students had got A1 grade while only 6,111 students got the coveted grade this year. More girls -- 70.62% -- cleared the exam as compared to 59.58% boys. Science, mathematics and even languages played spoilsport for lakhs of Class

X students this year. The highest number of failures, 2.37 lakh, was reported in science followed by 1.97 lakh flunking standard and basic maths. The results of the Gujarat Secondary and Higher Secondary Education Board (GSHSEB) Class 10 exams were declared on Thursday, and showed that pandemic continues to hurt students' academic performances. The success rate of Class 10 students this year was 64.62%, which is a percentage point than in 2022. The number of students scoring over 90% marks or getting the A1 grade fell drastically. This year, 6,111 students got the A1 grade by scoring 90%, which was half the number in 2022. A total of 12,090 students had got the A1 grade in 2022. Experts said that as seen in the Class 12 science stream results, the worse showing was the effect of learning loss due to online education during the Covid lockdowns.

Aaswa Trading and Exports Limited									
Regd. Office: 32, Milan Park Society, Nr. Jawahar Chowk, Maninagar, Ahmedabad-380008 Corp. Office: 8th Floor, VP Capital Building, Range Hill Road, Opp. Hotel Synnagar, Shalimar, Bhubaneswar, Pune-411007 CIN: L01100G1084PL00000000									
Extract of Standalone Audited Financial Results for the quarter and year ended as on 31st March, 2023 (In Rs. Lakhs)									
S. N.	Particulars	Quarter Ended		Year Ended		Quarter Ended		Year Ended	
		31-03-2023 Audited	31-12-2022 Unaudited	31-03-2023 Audited	31-03-2022 Audited	31-03-2023 Audited	31-03-2022 Audited	31-03-2023 Audited	31-03-2022 Audited
1	Total Income from Operations	100.00	20.00	-	120.00	-	-	-	-
2	Net Profit (Loss) for the period before tax, exceptional and Extraordinary Items	92.36	17.16	(0.22)	109.52	(0.07)	-	-	-
3	Net Profit (Loss) for the period before tax (after exceptional and Extraordinary Items)	92.36	17.16	(0.22)	109.52	(0.07)	-	-	-
4	Net Profit (Loss) for the period after tax (after exceptional and Extraordinary Items)	69.58	12.38	(0.15)	81.96	(0.02)	-	-	-
5	Total Comprehensive Income (or Loss) comprising profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax)	69.58	12.38	(0.15)	81.96	(0.02)	-	-	-
6	Equity share capital (of Rs. 10/- each)	72.90	72.90	72.90	72.90	72.90	-	-	-
7	Reserves (excluding revaluation reserve) as shown in the Audited Balance Sheet of the Previous Year	-	-	-	-	-	100.20	-	-
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)	9.66	1.72	(0.02)	11.38	-	-	-	-
9	Basic & diluted	-	-	-	-	-	-	-	-

The above is an extract of the detailed formal of Standalone Audited Financial Results for the quarter and year ended as on 31st March, 2023 filed with the Stock Exchange under Regulation 33 of SEBI (Listing and other Disclosure Requirements) Regulations, 2015. The full form of the Standalone Financial Results are available on the website of the Stock Exchange and the company at www.aaswadotcom and www.aaswadotcom.
The above financial results of the Company are reviewed and recommended by the Audit Committee and have been approved by the Board of Directors at their respective meetings held on May 26, 2023. These results have been subjected to audit by statutory auditors who have expressed an unqualified opinion.

For Aaswa Trading and Exports Limited
Sd/-
Umesh Kumar Sahay
Managing Director (DIN:01733696)

PHYSICAL POSSESSION NOTICE

ICICI Bank
Branch Office: ICICI Bank Ltd., Office Number 201-B, 2nd Floor, Road No. 1
Plot No-B3, WIPIT Park, Wagle Industrial Estate, Thane, Maharashtra- 400604

Whereas The undersigned being the Authorized Officer of ICICI Bank Limited under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13(12) (iv) Rule 3 of the Security Interest (Enforcement) rules 2002, issued demand notices upon the borrowers mentioned below, on underlying pool assigned to ICICI Bank by Dewan Housing Finance Ltd.) in relation to the enforcement of security in respect of a housing loan facility granted pursuant to a loan agreement entered into between DHFL and the borrower, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice.
As the borrower failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below mentioned dates. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of ICICI Bank Limited.

Sr.	Name of the Borrower/ Number Loan Account Number (DHFL Old LAM & ICICI New LAM)	Description of Property/ Notice Amount (Rs.)	Date of Demand Notice/Amount in Demand (Rs.)	Name of Branch
1.	Dineshbhai Naranbhai Chhaya/ Manita Dineshbhai Chhaya- UZSR000005036715 (ICICI No. 4100005946)	Plot No. 129, Shiv Dharma Residency-2, Near Garden City Park-1 And Part-2, [Moje Jawa Surat 39430-35, May 24, 2023 Rs. 10,32,992/-]	December 11, 2019	Surat

The above-mentioned borrower(s)/ guarantor(s) are hereby given a 30 day notice to repay the amount, else the mortgaged property will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under the Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.

Date: May 26, 2023
Place: Surat
Authorized Officer
ICICI Bank Limited

SHRIRAM Finance Limited

Head Office: Level-3, Wockhardt Towers, East Wing C-2 Block, Bandra Kurla Complex, Bandra (East), Mumbai 400 051.
Tel: 022 4241 0400, 022 4060 3100. Website: www.shriramfinance.com Registered Off: Sri Towers, Plot No. 14A, South Phase Industrial Estate, Guindy, Chennai 600 032. Ahmedabad Branch Off: Sadguru Arcade, Nr. Tower Chowk, Above Axis Bank Rajmahal Road, Vernal- 362265.

NOTICE-IV-A [See provision to rule 8(5) & 9(1)] AUCTION NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES

APPEND: It is informed that "SHRIRAM CITY UNION FINANCE LTD" has been amalgamated with "SHRIRAM TRANSPORT FINANCE LIMITED" as per order of NCLT, Chennai. Subsequently the name of "SHRIRAM TRANSPORT FINANCE LIMITED" was changed as "SHRIRAM FINANCE LIMITED" with effect from 30.11.2022 vide Certificate of Incorporation pursuant to change of name dated 30.11.2022.

E-Auction Notice for Sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provision to Rule 9(1) of the Security Interest Enforcement Rules, 2002.

Notice is hereby given to public in general and in particular to the Borrower/s and Guarantor/s that the below described immovable properties mortgaged/charged to the Shriram Finance Limited. The physical possession of which have been taken by the Authorized Officer of Shriram Finance Limited (Earlier known as Shriram City Union Finance Limited) will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis in e-auction on 12/06/2023 between 11 AM to 1 PM for recovery of the balance due to the Shriram Finance Limited from the Borrower/s and Guarantor/s, as mentioned in the table, Details of the Borrower/s and Guarantor/s, amount due, short description of the immovable property and encumbrances known thereon, possession type, reserve price and earnest money deposit and increment are also given as:

Name of Borrowers/ Co-Borrowers/ Guarantors/Mortgagers	Date & Amount of 13(2) Demand Notice	Total Outstanding Amount	Reserve Price (Rs.) & Bid Increment	Earnest Money Deposit (EMD) Details.	Date & Time of Auction	Contact Person and Inspection date
1.) S.N.TOWYORLD (Prop. Sureshbhai N. Patel) G-1, Harsh Complex, Opp. Motilal K. Chali, Nr. APC Vidhya Nagar Road, Anand-388001	To pay an amount of Rs. 88,31,741/- (Rupees Eighty Eight Lakhs Thirty One Thousand Seven Hundred Forty One only) as per Foreclosure dated 6th May 2022, under loan account No. RSBARTF 21061 00002	To pay an amount of Rs. 1,04,13,151/- (Rupees One Crore Four Lakhs Thirteen Thousand One Hundred Fifty One only) as per Foreclosure dated 31st May 2023, under loan account No. RSBARTF 21061 00002 & RSBARTF 202140001 along with further interest together with cost and Charges.	Rs. 92,03,000/- (Rupees Ninety Two Lakhs Thirty Thousand Only) Bid Increment: Rs. 50,000/- (Rupees Fifty Thousand Only)	EMD amount to be deposited by way of RTGS/ NEFT to the account details mentioned herein below in favour of Shriram Finance Limited BANK NAME- AXIS BANK LIMITED B R A N C H - D R. RAJAKRISHNAN SALAI, MYLAPORE, CHENNAI BANK ACCOUNT NO- 006010200057449 I F S C C O D E - UTIB0000006 Website of the service provider https://www.axisbank.in for bid documents details of the secured asset put up for auction/ obtaining the bid form	12th June 2023 11.00 a.m. to 01.00 p.m.	Mr. Kamlesh Chauhan 9825006737 Mr. Debajyoti Roy 9874702021
2.) Sureshbhai Nanjibhai Patel 3.) Patel Varshaben Sureshbhai SI No. 2 & 3 are R/o-A-5, Ravikiran Flat, Near Chitrangana, Vallabh Vidyanagar Road-Anand-388001	Foreclosure dated 6th May 2022, under loan account No. RSBARTF 21061 00002 & RSBARTF 202140001 along with further interest together with cost and Charges. Demand Notice Dated:-07-05-2022	To pay an amount of Rs. 1,04,13,151/- (Rupees One Crore Four Lakhs Thirteen Thousand One Hundred Fifty One only) as per Foreclosure dated 31st May 2023, under loan account No. RSBARTF 21061 00002 & RSBARTF 202140001 along with further interest together with cost and Charges.	Rs. 9,20,300/- (Rupees Nine Lakhs Twenty Thousand and Three Hundred Only) Last Date for Submission of EMD: 9th June 2023 10.00 a.m. to 05.00 p.m.	EMD amount to be deposited by way of RTGS/ NEFT to the account details mentioned herein below in favour of Shriram Finance Limited BANK NAME- AXIS BANK LIMITED B R A N C H - D R. RAJAKRISHNAN SALAI, MYLAPORE, CHENNAI BANK ACCOUNT NO- 006010200057449 I F S C C O D E - UTIB0000006 Website of the service provider https://www.axisbank.in for bid documents details of the secured asset put up for auction/ obtaining the bid form	12th June 2023 11.00 a.m. to 01.00 p.m.	Mr. Kamlesh Chauhan 9825006737 Mr. Debajyoti Roy 9874702021

Registration District & Sub District Anand District Anand Majje : Anand lying being land bearing Survey No.766/1, measuring 2125 sq.mtrs. T.Pno.7, Final Plot No.284, measuring 1722.00 sq.mtrs., Paiki 16,630 sq.mtrs. Known as "Mile Stone" Semi basement floor, Shop No. SB/1 super built up measuring 76.04 sq.mtrs. i.e 818 sq.ft., undivided share of land measuring 16,630 sq.mtrs at Registration District & Sub District Anand East:- By Margin, West:- By Margin Open Space, North:- By Margin Open Space, South:- By Shop No SB/2

STATUTORY 15 DAYS NOTICE UNDER RULE 9 (1) OF THE SECURITY INTEREST (ENFORCEMENT) RULES, 2002
The borrower/mortgagors/guarantors are hereby notified to pay the sum as mentioned above along with up to dated interest and ancillary expenses before the date of e-auction i.e. 12/06/2023, failing which the property will be auctioned/sold and balance dues, if any, will be recovered with interest and cost. For detailed terms and conditions of the sale, please refer to the <https://www.shriramfinance.in/auction> provided in the Shriram Finance Limited website.

Place : Anand
Date : 27-05-2023
Sd/- Authorised Officer
Shriram Finance Limited

Reliance Consumer Products partners with General Mills



Ahmedabad, Reliance Consumer Products Limited (RCPL), the FMCG arm and a wholly-owned subsidiary of Reliance Retail Ventures Limited (RRVL), today announced its foray into the western snacks category with the launch of Alani's Bugles in India. For the first time ever, snackers in India can enjoy Bugles, the international corn chips snacks brand with more than 50 years of heritage, owned by General Mills and available across major global markets including the UK, US and the Middle East. Speaking on the launch, an RCPL spokesperson said, "With the launch of Alani's Bugles, we want to ensure that the aspirational Indian consumer gets to taste and enjoy rich and premium offerings to satiate their snacking needs. We intend to actively participate in the growing western snacks market with greater focus on taste profile and overall experience. We are excited to launch range of Alani's snacks starting with Bugles, which is yet another step towards expanding our footprint in the FMCG market." Alani's Bugles will offer a top-notch snacking experience to Indian consumers and will be available at pocket-friendly price points starting from Rs 10 in flavours such as Original (Salted), Tomato and Cheese. The launch is in line with RCPL's vision of offering quality products to Indian consumers at affordable price points.

Boycott of Parliament building inauguration

insult to country: Gujarat CM Bhupendra Patel

GANDHINAGAR: Chief minister Bhupendra Patel on Thursday criticized the decision of several opposition parties to boycott the inauguration of the new Parliament building, saying it was an insult to this great nation and an attack on the country's democratic values. PM Narendra Modi will inaugurate the new building on Sunday. Opposition parties said the inauguration of the building by the PM amounts to "completely sidelining President Droupadi Murmu, which is not only a grave insult, but a direct assault on our democracy which demands a commensurate response". They contend that President Murmu should do the honours as she is not only the head of state, but also an integral part of the Parliament as she summons, prorogues and addresses it. CM Patel said the decision to boycott the inauguration ceremony is "highly

Kesar turns 89, still as sweet a palate tempter



RAJKOT: Age is indeed sweetening kesar, which almost on the threshold of 90, is undisputedly still the most sought-after among mangoes.

On Thursday, the mango species celebrated its 89th birthday after the Nawab of Junagadh Mahabat Khan III gave kesar its moniker on May 25, 1934. Folklore has it that after tasting the fruit for the first time, the nawab was so impressed by its sweetness that he not only gave it a name but also raised the salary of his garden superintendent S K Iyengar by Rs3. Legend has it that there were a few mango trees on the outskirts of Vantoli adjacent to which, a small mango orchard lay owned by Shalebhai Idi Shalebhai, who was the wazir of Junagadh's nawab, tasted the ripened mangoes and sent some to his friend Sheikh Saheb of Mangrol too in the 1930s. Shaikh named the fruit as 'Salebhai ni Amd'. According to history, nawab sent his garden superintendent Iyengar to various parts of the country and even abroad to places like Indonesia, Malaysia, Singapore, and China to study mangoes and spent Rs 34 for the trips abroad. However, Iyengar could not find a mango that tasted like kesar. Iyengar then learned about the sweet mango variety and went to Mangrol to get a first-hand taste. He liked the taste so much that he prepared 75 grafts and cultivated Salebhai

ni Amd' in Junagadh's forest area. When the trees finally bore fruit after three years, Iyengar took the ripened fruit to the nawab. Professor D K Varu, head of the horticulture department of Junagadh Agricultural University (JAU), said, "According to history narrated by Iyengar, nawab named the mango 'kesar' being amazed by its taste and hiked Iyengar's salary by Rs3 besides gifting a pair of clothes to him and his wife. The nawab also gifted clothes to other farmers." Pradyuman Khachar, a history teacher in a Junagadh college, said, "In 1935, there was a mega show organized of mangoes from across India in Junagadh where kesar won the first prize."

WESTERN RAILWAY

MATERIAL MANAGEMENT DEPARTMENT
VARIOUS MATERIALS SUPPLY

E-PROCUREMENT TENDER NOTICE No.S/14/2023 Date 25.05.2023

S.N.	Short Description of Item	Quantity	T.O.D.
194	Microprocessor Controller	102 Nos	1-June-2023
195	Anti Vibration Mounting Pad (AVM)	5488 Nos	2-June-2023
196	G.I Mild Steel Tubes (ERW)	7715 Mtr	5-June-2023
197	Manufacture and Supply of Pre-Stressed Mono Block Concrete Sleepers (pre-tensioned type) for Broad Gauge (1673 mm) for 1 in 8.5 Turnout Sets to Suit 60 Kg UIC Rail as per RDSO Drg No T-4665	91 Set	5-June-2023
198	Anesthesia Work Station Machine With Accessories	1 Nos	6-June-2023
199	Food Sling Manipulator Complete as per ICF Drg no. - ICF STD-2-4-001, alt-qNILL COL 1 (kili, Quantity specified)	1334 Nos	8-June-2023
200	D.L Sheet-3mm (ICF)	2344 Nos	9-June-2023
201	Procurement of Variable Displacement Pump/Plunger	2 Nos	12-June-2023
202	Procurement of Various Types of Copper Cables For The Track Machine	114320 Mtr	12-June-2023
203	Clamps For Joggled Fish Plates BG 60 kg (UIC) Along With Fittings as per RDSO drawing No. T-4017	10000 Set	12-June-2023
204	22.22mm DIA. Lock, Bolt & Collar For Freight Sling	76270 Nos	14-June-2023
205	25 KV / 2 x 855 V, 1250 KVA, Oil Cooled Transformer	1 Nos	15-June-2023
206	Dual Acting Hydraulic Shock Absorber For Vertical	440 Nos	16-June-2023
207	Cable Harness From Switch Board Cabinet	78 Set	19-June-2023
208	Non Asbestos Based Low Friction Composition Brake Block	11462 Nos	19-June-2023
209	Yaw Damper	3105 Nos	19-June-2023
210	2D Electro Physiological Study For DSA CATH LAB With Specification Attached With 2 Years Warranty	1 Nos	19-June-2023
211	Bogie Frame Assembly	3 Set	20-June-2023
212	Set of Pneumatic Cook	80 Set	20-June-2023
213	Side Frame Key For CTRB	103286 Set	22-June-2023
214	Modified Flat Door	2087 Set	27-June-2023
215	Overhauling Kit For Pump Valve	340 Set	30-June-2023
216	Load Sensing Device	1228 Nos	30-June-2023
217	Manufacture and Supply of Pre-Stressed Mono Block Concrete Sleepers (pre-tensioned type) for Broad Gauge (1673mm) as per RDSO Design for RDSO Drg. No. RDSO/T-5838 to T-5808	62 Set	30-June-2023
218	Manufacture and Supply of Pre-Stressed Mono-Block Concrete Wider Sleeper Guard Rails For Bridge Approach to RDSO Drg. No. T-8971 to T-8978	240 Set	30-June-2023
219	Manufacture and Supply of Wider Base Mono-Block Concrete Sleeper For Level Crossing to RDSO Drg. No. T-8869 (Pre-Tensioned Type) for Broad Gauge (1673mm)	2741 Nos	30-June-2023
220	CCPU Side Bearer Pad Assembly Complete	2326 Nos	03-July-2023
221	Hanger For Bogie Bolster Spring Suspension	15786 Nos	06-July-2023
222	Two Part Sliding Door Arrangement	514 Nos	14-July-2023
223	Ball Joint Tractor Lever	18064 Nos	21-July-2023
224	Yoke For Upgraded High Tensile CBC	1424 Nos	26-July-2023

REVERSE AUCTION

19 Rate Contract For One Year For PVC Insulated, Armoured, Unscreened Underground Heavy Gauge Signalling Cable As Per IRIS-3/63/2014 REV.5 Size 12 CORE X 1550 MM 7500 Km | 07-June-2023 || 20 Development, Supply, Installation, Testing & Commissioning of Passenger Emergency Talk Back System | 93 Nos | 09-June-2023 |
21 Main LED Signal Lighting Unit - Red , Yellow & Green	9500 Nos	13-June-2023
22 Sealed Maintenance Free VRLA Battery 2V300AH	14500 Nos	19-June-2023
23 LED Signal Lighting Unit For Route, Shunt & Calling On	8800 Nos	03-July-2023

Regarding detailed notice EMD, Purchase restrictions and detailed tender conditions, please visit website www.irps.gov.in in as much as possible. For Principal Chief Materials Manager
www.wr.indianrailways.gov.in

Like us on Facebook/WesternRail follows us on Twitter.com/WesternRail

DISHA RESOURCES LIMITED

REGD. OFFICE: 3, RAJESH APARTMENT, B/H, AJANTA COMM. ESTATE, ASHRAM ROAD , AHMEDABAD-380014

PHONE: (OFF). 2754-0790, 27543060 E-MAIL: disharesourceslimited@gmail.com
CIN: L7410GJ1995PLC024869 Website: www.disharesourcesltd.com

EXTRACT OF AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR QUARTER AND YEAR ENDED ON 31ST MARCH, 2023 (In Lakhs except EPS)

PARTICULARS	Quarter ended on 31/03/2023 (Audited)	Year ended on 31/03/2023 (Audited)	Corresponding 3 months ended in the previous year 31/03/2022 (Audited)
Revenue from operations	143.75	371.19	33.35
Other Income	27.74	67.70	-
Total Income from Operations	171.49	438.89	33.35
Net profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	22.29	44.53	24.46
Net profit/(Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	22.29	44.53	24.46
Net profit/(loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	20.31	39.08	24.46
Total Comprehensive Income for the period comprising Profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax)	(454.70)	590.39	375.97
Paid-up equity Share Capital	731.55	731.55	731.55
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	2729.28	2729.28	2141.39
Earnings per Share (of Rs. 10/- each) (for continuing operations)	(6.22)	8.07	5.14
-Basic	(6.22)	8.07	5.14
-Diluted	(6.22)	8.07	5.14

Notes:
1. The above is an extract of the detailed formal of quarter and year ended Audited Financial Results filed with the stock exchange under Regulation 33 of the SEBI (Listing and other Disclosure Requirements) Regulations, 2015. The full form of the Audited Financial Results is available on the stock exchange website - www.bseindia.com on company's website - www.disharesourcesltd.com
2. The above financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in the meeting held on 26th May 2023.
3. The company has adopted Indian Accounting Standard ("IND AS") notified by the Ministry of Corporate Affairs with effect from 1st April, 2017. Accordingly the Financial Result for the quarter and year ended on 31st March, 2023 in accordance with IND-AS and other accounting principles generally accepted in India.

FOR, DISHA RESOURCES LIMITED
KRISHNA AWATAR KABRA
MANAGING DIRECTOR
DIN: 00650817
Date : 26-05-2023
Place: Ahmedabad